

SHREE VASISHTHA VIDHYALAYA



English Medium



Name: _____

Std.: IV

Roll No.: _____

Div.: _____

Dear Parents,

Warm Greetings!

Summer break is a vacation time student eagerly wait for when they can relax, visit friends and family, travel to see places and basically enjoy those little pleasures of life which get left behind during the busy school routine.

To ensure that the children have a constructive holiday, some holidays' homework have been given which will keep the child active and observant. These assignments can easily be done by the children and you could assist only where required. Working together will not only help your child to build, learn and develop his/her skills but also strengthen your bond with him/her.

Please note:

- Holiday homework has to be done under the parental guidance.
- The holiday homework will be assessed and its marks will be calculated in Term-1 Exam.

Submission Date:- 17/06/2025

Wishing all of you a relaxing, joyful holiday filled with memorable time with your family.

Regards SVV.

Summer Assignment

Maths

The Pin Code represents a system which divides the country into different regions, so for better communication codes are given to different cities of Gujarat.

Find the Pin Code of Surat, Vadodara, Ahmedabad, Rajkot, Gandhinagar, Porbandar, Patan, Navsari, Valsad and Vapi.

❖ **Present the above data in a tabular form.**

Cities	Pin code

❖ **Write the sum of the Pin codes of Surat, Vadodara, Ahmedabad and multiply the Pin codes of Navsari and Valsad.**

<u>Addition</u>	<u>Multiplication</u>

❖ **Find the difference between the greatest and smallest Pin Code.**

--

Science

Draw and colour the picture of your favourite meal(lunch / dinner) and note down the nutrients you will get from it in a tabular form.

For example:

Name of meal	Name of the items	Name of Nutrients
Lunch	Dal Rice Mix vegetables	Protein Carbohydrates Vitamins and minerals

Are you getting all the nutrients? Is it a balanced diet?

➤ **Homework to be done on an A-4 size paper.**

S.st / English

Paste or draw 5 Community helpers in a scrap book and do as directed:

- 1) Write their names (common noun) e.g. teacher
- 2) Write one sentence on how they help us.
- 3) One Adjective describing these helpers. e.g kind, caring, etc.

2nd Language Hindi/Gujarati

પારંપરિક खेल वो गतिविधियाँ हैं जो हमारी सांस्कृतिक विरासत का हिस्सा है। जैसे -कबड्डी, खो-खो, गिल्ली-डंडा, शतरंज, इत्यादि। गर्मी की इन छुट्टियों में आपने अपने परिवार के साथ कौन- कौन से पारंपरिक खेल खेले ? किन्ही दो खेलों के नाम लिखें और उन खेलों के बारे में बताते हुए तीन से चार वाक्य लिखें।

પારંપરિક રમત એ ક્રિયાઓ છે જે આપણો સાંસ્કૃતિક વારસાનો હિસ્સો છે. જેમકે, કબડ્ડી, ખો-ખો, ગિલ્લી ડંડો, ભમરડો ફેરવવો, શતરંજ વગેરે.....આ ગરમીની રજાઓમાં તમે તમારા પરિવારની સાથે કઈ કઈ પારંપરિક રમતો રમી ? કોઈપણ ત્રણ રમતોના નામ લખો અને રમત રમતા કોઈ બે ચિત્ર લગાવો.

Homework to be done on an A-4 size paper.



SUMMER VACATION DO's & DON'Ts FOR STUDENTS

A guide to having fun, staying smart, and being awesome all summer!

☑ DO's – Be Bright, Be Brave, Be Balanced

- **Make a daily routine:-** balance study, fun, and rest
- **Read story books:-** improve imagination and vocabulary
- **Help parents with small chores:-** like cleaning your room
- **Spend time outdoors:-** play games, but stay safe from heat
- **Practice a hobby :-** drawing, dancing, sports, anything you love
- **Revise schoolwork a little every day :-** keep your mind fresh
- **Drink lots of water and eat healthy :-** stay hydrated and strong
- **Learn something new :-** like a craft, cooking, or a new language
- **Sleep early and wake up early :-** keep a healthy body clock
- **Be kind and spend time with family :-** build good memories



✗ DON'Ts – Ditch the Drains!

- **Don't stay glued to screens :-** limit mobile time, and gaming time
- **Don't skip meals:-** eat proper, nutritious food
- **Don't sleep too late :-** it can make you feel lazy and tired
- **Don't forget about books:-** read a little every day
- **Don't stay indoors all day :-** get some fresh air and sunshine
- **Don't waste water and electricity :-** be responsible
- **Don't fight with siblings or friends :-** enjoy peaceful time
- **Don't ignore your talents :-** this is the best time to grow
- **Don't be careless about hygiene :-** bath daily and stay clean
- **Don't be lazy all vacation :-** stay active and creative

